

ત્વરિત જાહેરાત માટે

દરેક દ્વાર પાછળની કથાને ભાળો

ડોર્સ ઓપન 2019 (Doors Open 2019) દરમિયાન બ્રેમ્પટનનાં ઈતિહાસ, વારસો તેમજ અજોડ સાંસ્કૃતિક પરંપરાઓને માણો.

બ્રેમ્પટન, ઓન્ટારિયો (16 સપ્ટેમ્બર 2019) – 28 સપ્ટેમ્બર 2019નાં રોજ સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી રહેવાસીઓ અને મુલાકાતીઓને ડોર્સ ઓપન ખાતે બ્રેમ્પટનનાં ઈતિહાસ, વારસો તેમજ અજોડ સાંસ્કૃતિક પરંપરાઓને માણવા માટે આમંત્રણ આપવામાં આવે છે. બ્રેમ્પટનનાં 20 કરતા વધુ રોમાંચક સ્થળો પોતાના દ્વાર જાહેર જનતા માટે ખુલ્લા મુકશે જેથી જનતા આ સ્થળોની વણકહેલ વાર્તાઓની સોડમ માણી શકે.

વિક્ટોરિયન યુગના ઉત્તમ રીતે સચવાયેલ બાંધકામોથી લઈને ચાલીને કરવાની સહેલોથી લઈ ઉપાસના કરવાના આધુનિક સ્થળો સુધી બ્રેમ્પટનની દરેક ગલીમાં કોઈને કોઈ વણકહેલ કથાની સોડમ છૂપાયેલ છે. શસ્ત્રાગારનો ઈતિહાસ જાણવા મળશે, બ્રેમ્પટનનાં થીએટરોની બેકસ્ટેજ ટૂર કરી શકાશે અને અમારી આધુનિક ટ્રાન્ઝિટ સિસ્ટમને ખુંદી શકાશે. આખા બ્રેમ્પટન ફરતે દરેક સ્થળ એક બંધન રહિત, અજોડ અને પડદા પાછળનું દ્રશ્ય લઈને બેઠું છે.

ભાગ લેનાર સ્થળોની સૂચિ અને વધુ વિગતો માટે અહીં મુલાકાત લો brampton.ca/doorsopen.

ડોર્સ ઓપન (Doors Open) થકી નિવાસીઓને તાજેતરમાં જ પુનરુત્થાન થયેલ લેસ્ટર બી. પિઅરસન (LBP) થીએટરની મુલાકાત લેવાની પહેલવહેલી તક સાંપડશે. આ જબરદસ્ત કલાપ્રદર્શનનું સ્થળ વધારવામાં આવેલ સુગમતા અને સુરક્ષાનાં પગલાં, આધુનિક ફ્રન્ટ-ઓફ-હાઉસ એરિયા અને આધુનિક તકનિકી સાધનો ધરાવવાનું ગૌરવ લે છે.

મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown) અને કાઉન્સિલરો નિવાસીઓને LBPનાં ઉદ્ઘાટન પ્રસંગે ડોર્સ ઓપન માટે સવારે 10 વાગ્યે હાજર રહેવાનું આમંત્રણ પાઠવે છે. નિવાસીઓને આર્કિટેકટ્સ લેબેલ અને બૂલેઈન (Lebel & Bouliane)ને મળવાની તક મળશે, લાઈવ મનોરંજન માણી શકશે, અને અપગ્રેડ કરેલ સવલતને જાણી લેવાની સહેલમાં જોડાઈ શકશે.

LBPનાં નવપરિવર્તન અંગે વધુ જાણકારી મેળવવા માટે brampton.ca/lbp.

ઓન્ટારિયો હેરિટેજ ટ્રસ્ટ (Ontario Heritage Trust) ઓન્ટારિયોમાં વિવિધ સમાજો સાથે કાર્ય કરે છે કે તેઓ પોતાની અજોડ સાંસ્કૃતિક સાઈટ્સનાં દરવાજા, દ્વારો અને આંગણા દર વર્ષે ડોર્સ ઓપન માટે ખુલ્લા મુકે.

વધુ માહિતી માટે, doorsopenontario.on.caની મુલાકાત લો.

બ્રમ્પટનનું ડોર્સ ઓપન સપ્ટેમ્બર 27મીથી 29મી સુધી કલ્ચર ડેઝ વાળા સપ્તાહનાં અંતિમ દિવસોમાં હાથ ધરવામાં આવે છે જે શહેરનાં રોમાંચક સાંસ્કૃતિક અનુભવોમાં વધારો કરે છે. કલ્ચર ડેઝ કલા અને સંસ્કૃતિની રાષ્ટ્રીય ઉજવણી છે જ્યારે નિવાસીઓ અને મુલાકાતીઓ આખા બ્રમ્પટનમાં નિઃશુલ્ક, પારિવારિક પ્રવૃત્તિઓને માણી શકે છે. આ વર્ષે ભાગ લેનાર સંગઠનોમાં પીલ આર્ટ ગેલરી મ્યુઝિયમ એન્ડ આર્કાઈવ્સ (PAMA), દ ફેસ્ટિવલ ઓફ લિટરરી ડાઈવર્સિટી (FOLD) અને બ્રમ્પટન લાઈબ્રેરી સામેલ છે.

કલ્ચર ડેઝ પ્રવૃત્તિઓની આખી સૂચિ માટે અહીં મુલાકાત લો culturedays.ca.

અવતરણો

"બ્રમ્પટન રંગોથી ભરેલ સાથિયો છે અને આપણી સૌથી મોટી શક્તિ છે આપણી સંસ્કૃતિ. આપણો સમાજ અમાપ વૈવિધ્ય ધરાવે છે અને દરેક દ્વાર પડખે કોઈનેકોઈ કથા આકાર લઈ ચુકી છે. હું બધાંને બ્રમ્પટનની સંસ્કૃતિ અને વૈવિધ્યના દર્શન ડોર્સ ઓપન 2019માં કરવા આહવાન કરું છું"

- મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)

"ડોર્સ ઓપન ઈતિહાસ, વારસો તેમજ અજોડ સાંસ્કૃતિક પરંપરાઓ મારફત બ્રમ્પટનને જાણવાની નિવાસીઓ તેમજ મુલાકાતીઓ માટે એક જોરદાર તક છે. અમને આ અજોડ પ્રસંગનો ભાગ હોવાનો ગૌરવ છે અને બ્રમ્પટનનાં કેટલાક અત્યંત રસપ્રદ સ્થળો ખુલ્લા જનતાનું સ્વાગત કરીએ છીએ.

- પ્રાદેશિક પરિષદ સભ્ય (રીજનલ કાઉન્સિલર) ગુરપ્રીત ધિલ્લોન, પ્રમુખ, ઈકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચર

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://www.facebook.com/brampton), અને [Instagram](https://www.instagram.com/brampton) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

मिडिया संपर्क:

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी अंगेजमेन्ट

व्यूहान्मक संवाट

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca